

ખર્ચેલા ખાડુખલ

રજુઆત

પેલો ધર્સટર



ਲੇਖਕ: Edward Hughes

ਵਾਖਾ ਕਰੇਵਾਰ: Janie Forest
Alastair Paterson

ਡੈਰਫਾਰ ਕਰੇਵਾਰ: Lyn Doerksen

ਅਨੁਵਾਧਕ: Hanson Harry

ਪ੍ਰਸ਼ੰਸਕ ਕਰੇਵਾਰਾ: Bible for Children
www.M1914.org

©2020 Bible for Children, Inc.

ਅਧਿਕਾਰ ਪਤਰ—ਆਂਈ ਐਨ ਵਾਰਟਾਉ ਨਕਲ ਕਰੇਨੇ ਛਾਪੀ ਸਕੋਤਾ—ਝੁਕਤ
ਵੇਚਾਣ ਜੋ ਮਕਸਦ ਨ ਹੁਣੋ ਖਪੇ।



ઉ ખાઈ સોર ખકોર થીન્ધો વો એતી ઉચાળા
વારી જગા તે ઓભી વઈ,
એનજુ ઉધાસ અખીયુ
ભયાનક નજારો ઇસધી
વઈ, એન જો પોતર
મરી રયો વો. ઉ માં
મારીયા વઈ. ઉ ઓન
જગા તે ઓભી વઈ
જે ઈસુ કે કરોસ
તે ખીલા ઠોકે
મેં આયા વા.





ਹੀ ਮੇਡ ਕੀ ਥ੍ਯੋ? ਏਤਰੀ
ਧਰਮਭਰੀ ਰੀਤਾ ਈਸੁ ਜੋ ਸੁਨਘਰ
ਜਿਥਾ ਖਤਮ ਥਈ ਵਿੰਦੀ?

ਪਰਮੇਸ਼ਵਰ ਕੋਲਾਇ
ਏਡੀ ਰਝਾ ਝਨਾ ਕੇ
ਏਨ ਕੇ ਪੋਤਰ ਕੇ
ਕਰੋਸ ਮਥਾ ਖੀਲਾ

ਛੋਕਨੇ ਹੁਣੀ ਵਧੇ ਮੇਂ ਅਚੇ?
ਕੋਰੋ ਈਸੁ ਕੋਈ ਭੋਲ ਕੁੱਵੇ?
ਕੋਰੋ ਪਰਮੇਸ਼ਵਰ ਸੇ ਕੋਈ
ਭੋਲ ਥਈ ਵਈ.





ਨਾ! ਪਰਮੇਸ਼ਵਰ ਕੋਈ ਭੋਲ
ਨ ਕੈਵੇ, ਈਸੁ ਸੇ ਕੋਈ ਭੋਲ
ਨ ਥਈ ਵਈ. ਈਸੁ ਹਮੇਸ਼
ਜਾਣਿਨਾ ਵਾਂਕੇ ਕੋਕ ਕੁਡੀ
ਮਾਡੀ ਹੀ ਏਨਕੇ ਹਉਣੀ
ਵੀਜਧੀ. ਏਨ ਸੁਧੀ ਕੇ ਜਦੇ
ਈਸੁ ਨਾਂਗਾ ਵਾਂਕੇ ਸਾਈਮਨ
ਨਾਲੇ ਜੋ ਹਕੂਡੀ ਘੁਣੀ ਮਾਡੀ
ਮਾਰੀਥਾ ਕੇ ਚੋਂ ਵੇਂਕੇ ਹੀ ਗੋਖ
ਕੇਤੀ ਪਾਣੀ ਅਚੀ ਸਕੇਤੀ.



ਈਸੂ ਜ

ਮੋਤ ਨੇ ਕਤਰਾਕ

ਤੀ ਮੋਰ ਹੁਕਮੀ ਖਾਈ

ਆਵਈ ਨੇ ਈ ਓਨੀਜੇ

ਪਗੇ ਤੇ ਅਤਰ ਜੋ ਛੱਟਕਾਵ

ਕੁੰ, ਹੀ ਪੈਸੇਜ ਭਰਮਾਧੀ

ਆਧ? ਏਨਜਾ ਚੇਲਾ

ਝੜੀਥਾਧ ਕੁਧਾ. ਈ ਖਾਸੋ

ਕੁਮ ਕੁੰ ਆਧ. ਈ ਏਡੋ ਮੁੰਜ

ਕੁਭਰ ਲਾ ਕੁੰ ਆਧ. ਕਤਰੀ

ਵੀਚੀਤਰ ਗਾਲ ਵਈ!



એન પોય ચઉધા, જોકો ઈસુ
જે ખારો ચેલે મેનુ હૈકડો વો
ચાંધી જે ત્રી સીકિ લા વે
પુજારી લા ઈસુ સે ધગો
કરેલા તૈયાર થઈ બ્યો.






યઉધીએ જે પરમ પોય, ઈસુ પિંડ
જો છેલો જેમણ પિંદજે ચેલે ભેરો
ખાધે. ઈનીને ઓનીકું પરમેશ્વર ને
એન જે વચ્ચન જુ અધભુત ગાલ ચેં કે
ઈ ઓની કે વલા કરેતા. ઈનીને ઓની
મોડ મે વેરાયલા માની ને પીઆલો
જના. હી ઓન ગાલ જુ ચાધગીરી
વદ્ધ કે ઈસુ જો
શરીર ને એન જો
લુદ્ધ પાપી એજા
ગોના માફ કે લા જને
મેં આયો આય.



તે દુસ્ટુ પિંફ જે ધોરણે કે ચેંકે કે એનસે ધર્ગો થીન્ધો ને આંદ્ધ
મેડ ભજુ વેન્ધા. “આઉ નઈ ભજા”, પિતર જીધ કું “કોકુડ
કોછધો તીના મોર ત્રે ફેરા તું મુંજો નકાર કરીને” દુસ્ટુ ચૈ.





ઓન રાતજો ઈસુ
ગોથસમની ભગ્નીચે
મેં પ્રાર્થના કરેલા વ્યા.
ઈનીજા ચેલા એની લેરા
વા. નેઓટે સુખી રયા.
હે મુંજા પરમપિતા, ઈસુ
પ્રાર્થના કેં હી પીઆલો
મુના છેટો ખણી વનો
છતાં પણ મુંજ ઈરછા
નાય પણ જેરી
આજ ઈરછા.



એન જેમ હક્કી વડી ભીડ ભરીયે મેં
આવછ. એનજો અગુઝો ચઉધા વો. ઈસુ
કોઈ પ્રતીકાર ન કે. પણ પિતર હક્કે
માડુ જો કન વઢી છે. ઈસુ
શાંતીનું ઉ માડુ જે કન કે
છબેને ઉ સાજો થૈ બો.
ઈસુ જાણધાવા કે
એને કે પુક્કે મે આયો
આય હી ઈશ્વર જ
ઈરછા જો હક્કો
મારા આય.




ਮਿਠ ਈਸੂ ਕੇ ਵੱਡੇ ਪੁਜਾਰੀ ਜੇ ਘਰੇ ਖਾਣੀ ਵਾ, ਓਤੇ ਯਉਧੀ ਵੱਡੇ
ਥਾ ਕੇ ਈਸੂ ਕੇ ਛਾਣੀ ਵੀਧੇ ਮੌਜੇ ਮੁਰ ਮੇਜ ਪਿਤਰ ਘੋ ਮਾਨ੍ਹ ਏ

ਭੇਰੋ ਓਭੋ ਰਈਨੀ ਸੇਕੋਟੀ ਗੇਨਧੋ
ਨੇਰੀਨਧੋ ਵੋ. ਤੇ ਫੇਰਾ ਮਾਨ੍ਹ
ਪਿਤਰ ਕੇ ਗੁਰੀਨੇ ਠਠਾਨੇ ਥਾ, ਤੁ
ਪਾਣੀ ਈਸੂ ਭੇਰੋ ਵੋ. ਤੇਥ ਫੇਰਾ
ਪਿਤਰ ਨਕਾਰ ਕੁੰ ਜੇਡੋ
ਈਸੂ ਚੋ ਵੇ ਛੇਡੋਜ ਕੁੰ,
ਹਤਰੇ ਸੁਧੀ ਕੇ ਪਿਤਰ
ਗਾਰ੍ਥੂ ਨੇ ਸਰਾਪ
ਠਨੇਲਾ ਲਗੋ.



ਮੋਕਦ - ੭ - ਘੁੰਗਾ

ਓਨਜ ਟੇਮ ਕੋਕਦ ਕੋਛਧਯੋ
ਹੀਤਾ ਈਕਵਰ ਜੋ ਅਵਾਜ
ਪਿਤਰ ਲਾ ਵੋ. ਈਸੂਜ
ਗਾਲ ਕੇ ਚਾਧ ਕਰੇਨੇ ਪਿਤਰ
ਖੋਰੇ ਰੋਨੇਲਾ ਲਗ੍ਗੋ.





यउधा पाण भारी डोभीवो. ही
जाणधो वो के ईसु को पाण पाप
के गोने ला धोषित न वो. यउधा
चांधी जा त्री सेका पाछा करे
जो कुं पाण पुजारी ही
गेनधा न.





યઉધા ચાંધીજા સેકા
ફોગાય ઠને, ને ખારા
વેની ને પિંદ નપુટો
ખાઈ ગણો.






ਪੁਜਾਰੀ ਈਸੂ ਕੇ ਪਿਲਾਤ, ਰੋਮ ਜੇ
ਰਾਜਾ ਵਟੇ ਖਾਣੀ ਅਚੇ, ਪਿਲਾਤ
ਚੋਂ ਆਂਉ ਏਨ ਮਾਡੁ ਮੇ ਕੋਈ ਧੋਖ
ਇਸਾਂ ਨਤੋ. ਪਾਣੀ ਭੀਓ
ਰਡੀਓ ਕੇਫੇ, ਏਨ ਕੇ
ਕੁਰਸ ਤੇ ਚਾਲਾਂ. ਏਨ
ਕੇ ਕੁਰਸ ਤੇ ਚਾਲਾਂ.



ਛੇਵਟ ਜੋ ਪਿਲਾਤ ਈਸੁ ਕੇ ਕੁਰਸ ਤੇ ਟੰਗਾਂਧ
ਜੋ ਹੋਕ੍ਰਮ ਕੇ, ਸਪਾਂਧ ਈਸੁ ਕੇ ਧੁਮ੍ਭਾ ਹਾਂਡੋ,
ਏਨ ਜੇ ਮੌ ਤੇ ਥੋਕ੍ਰਿ ਨੇ ਈਨੀਕ੍ਰਿ ਛਹੀ ਦੇ
ਛਾਂਬਾਂਧਾ. ਓਨੀ ਨੇ ਲਾਂਭੇ ਕੁਛੇ ਜੋ ਹੁਕਕੋ
ਮੁਗਾਟ ਭਨਾਂਧਾ ਨੇ ਈ ਏਨ ਜੇ ਮਥੇ ਤੇ ਠੋਕ੍ਰੀ
ਵਧਾ. ਤੇ ਪੋਧ ਓਨੀਨੇ ਏਨ ਕੇ ਮਾਰੀ
ਵਿਜੇਲਾ ਲਕ੍ਰੋ ਜੇ ਕੁਰਸ
ਤੇ ਘੀਲਾ ਦੇ
ਠੋਕ੍ਰੀ ਵਿਧਾ.



ਈਸੁ ਕੇ ਨਕਕੀ ਹੀ ਜਾਣ ਵਈ ਕੇ ਈ ਛੇਤੀ ਰੀਤੀ ਮਰੀ ਵੇਨਧਾ। ਈ ਹੀ
ਪਾਣੀ ਜਾਣਧਾ ਵਾ ਕੇ ਓਨੀਂ ਮੋਤ ਓਨ ਪਾਪੀ ਏਲਾ ਮਾਝੀ
ਫੁੱਲੀ ਜੋਕੇ ਓਨੀ ਮੇਂ ਵਿਸ਼ਵਾਸ ਰਖੇਤਾ।



ਈਸੁ ਭੇਰਾ ਅ ਗੋਨੇਗਾਰ ਕੇ ਪਾਣ
ਕੁਰਸ ਤੇ ਟੰਗਾਂਧ ਮੇਂ ਆਯਾ ਵਾ।
ਹੁਕਤੇ ਈਸੁ ਮੇਂ ਵਿਸ਼ਵਾਸ ਰਖਦੇ
ਵੋ— ਨੇ ਸਰਗ ਮੇਂ ਬਾਬੇ। ਘੋ
ਵਨੀ ਸਕਿਆ ਨ।



કલાકું જ પીરા ને પોય,
ઈસુ ચ્યા. હાણો પુરો ચ્યો.
ને વટાઈ બ્યો. એન જો
કમ થઈ બ્યો વો.

એન જે ભાઈખંધ
એન કે હક્કી કભર
મે ધર્દન કયા.




રોમન સપાઈ કુલર ણ
ચોકી કરે લા કુલર તે
સીલ લગાયા હાણે કોઈ
પણ મજારા તે બારા
અચી વની સગે ન.



જો હી વાર્તા જો અંત વે, ત
હી કટરો મેડ ડોખ જ ગાલ
ચોવાને પણ દુશ્વર ગય
મેડ ખાસો કયા.
દુસુ મુખો રદ
સગ્યા ન.



અડવારીયે જે પેદે હી, વેલી
ઓગે જો, હસુ જા કતરાક
ચેલા નેચ્છા કે કલર તે
રખલ વડો પાણો
લોડી બ્યો આય.



ઉ મંજારા જેડે ડા,
હસુ ઓતે ન વા.



હક્કી ખાઈ ઓતે ખમી રદ્ધિ. ને કલર વટે
રુંધી વૈ. એન કે ઈસુ ઇસાણા, ઈ બોરી
રાજુ થૈ ને ઓતે નું ધોરી વૈ, એ
ચેલે કે હી ગાલ વતાયલા. કે
ઈસુ જીરા આચ ઈસુ મોતનુ
વરી પાછા જીરા થ્યા ઈચ્છા.



તેરદ મે ઈસુ ચેલે વટે આયા. ને ખીલેજા વીધ
પિંફ જે હુથજા ઓની કે વતાયા ઈ સચો વો ઈસુ
વરી જીરા થૈબ્યા વા. ઉપિતર કે એન જે નકાર જે
કમ જ માઝી ડના. ને પિંફ જે ચેલે કે ઈસુ જે
આરેમે ચેજો અયા. પોચ ઉ સરગ મે હુલ્યા વા
જ્ઞતેનું ઈ પેલી નાતલ જો આયા વા.



પેલો ઈસ્ટર

ઈશ્વર ને વચન જ વાર્તા—ખાઈખલ

ઈનીમે જુડેતો

માથ્યી 26-28, લુક 22-24,
યોઆન 13-21

“જોકો આંજે જીયણ મે ઉજારો રીખેતા.”

ગીતશાસ્ત્ર ૧૧૬:૧૩૦



પુરો થીએતો



હી બાઈખલ જુ વાત્તી પાકે પાંજે મહાન ઈશ્વર ને બારે મેં
વતાયતી, જોકો પાકે ભનાય આય ને ઈ ઈન્દ્રીએતા કે આંઈ એની કે ઓરખો.

ઈશ્વર જાણેતા કે પાં ભોધડો કમ કયા ઈયો. જુનકે ઈ પાપ ચે આય. પાપ જુ સજા
મોત આય. પણ ઈશ્વર આકે ખોરો પ્રેમ કરીએતા ઈ પિંઠનો હકડો માતર પોતર, ઈસુ કે
હી ધોનિયા મેં હુલાય કે ફુસ મથા આંજે પાપજી સજા હી પિંઠ ભોગવીએ. ઈસુ મોઆ
પોય વરી જીરા વ્યા ને સરગ મેં પિઠને ધરે પાછા વરી વ્યા. જ આંઈ પ્રભુ ઈસુ મેં
વિશ્વાસ કરે ને ઈની વટે આંજે પાપજી માઝી મંગધા, ત ઈ આકે માઝે કેઈન્ધા, ઈ
અચીને આં ભેરા રોન્ધા ને આંઈ પણ અનંતકાર લા ઈની ભેરા રોન્ધા.

જ આંઈ વિશ્વાસ કર્યો તા કે હી સચ આય.

ત આંઈ ઈશ્વર સે હી ગ્રાર્થના કયો. પ્રિય ઈસુ, આઉ મનીઆ તો કે આંઈ ઈશ્વર ઈયો ને
આંઈ મુ પાપી લા માડુ ભનીને આયા ને મુલા કરેને ભરી વ્યા. ને હાણે આંઈ જીરા ઈયો
મેરભાની કરે ને મુંજે જીયણ મે અચો. ને મુંજા પાપ માઝે કયો. જેસે મુકે હાણે નયો
જીયણ મલે. ને આઉ હુમેસલા કરે ને અનંતકાર સુધી આં ભેરો રઈ સગા. આંજી આગ્યા
મને લા મુંજુ મધ્ય કયો. આંજો પોતર ભનીને આંજે લા જરો રઈ સગા. આમીન

રોજ બાઈખલ વાંચીઓ. ને ઈશ્વર સે ગાલ કરીઓ. યોઆન ૩:૧૬

